

ગુજરાત યુનિવર્સિટી

ઓનલાઇન પરીક્ષા વિકલ્પ પસંદગી આપવા અંગે મહત્વની સૂચનાઓ

તા. 08/12/2020

1. ગુજરાત યુનિવર્સિટી દ્વારા BSc Sem-3, B.Ed Sem-3, MA Sem-3, MSc Sem-3, M.Com Sem-3, B.Com Sem-5, B.A Sem-5, BBA Sem-5, BCA Sem-5, ની લેવાનાર આગામી ઓફલાઇન પરીક્ષાના વિકલ્પમાં ઓનલાઇન પરીક્ષાઓ અંગે આ વિકલ્પ માંગવામાં આવે છે.
2. વિદ્યાર્થીને ઓનલાઇન પરીક્ષા આપવા અંગેનો આ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ઓફલાઇન પરીક્ષા આપવા માટે કોઈ વિકલ્પ પસંદ કરવાનો રહેતો નથી.
3. ઓનલાઇન પરીક્ષા બહુ વિકલ્પી પ્રશ્નો (MCQ) આધારિત રહેશે. આપેલા જવાબોના વિકલ્પોમાંથી ફક્ત એક જ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
4. વિકલ્પ પસંદગી માટે વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર, મોબાઇલ નંબર તથા ઈ-મેલ દાખલ કરવાનો રહેશે. નોંધાવેલ ઈ-મેલ તથા મોબાઇલ નંબરનો ઉપયોગ ઓનલાઇન પરીક્ષા માટે કરવામાં આવશે, તેથી ઈ-મેલ તથા મોબાઇલ નંબર દાખલ કરવામાં તકેદારી રાખવી.
5. વિદ્યાર્થીએ નોંધાવેલા મોબાઇલ ઉપર ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કર્યા બાદ વિદ્યાર્થી પરીક્ષા અંગે વિકલ્પ પસંદગી કરી શકશે.
6. વિદ્યાર્થીએ પ્રદર્શિત પોતાના નામ તથા કોલેજના નામની સંપૂર્ણ રીતે ચકાસણી કરી લેવી. ત્યારબાદ જ ઓનલાઇન અંગેની પસંદગી આપી શકશે. એકવાર પસંદગી આપ્યા બાદ પસંદગી બદલી શકાશે નહીં. (એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે કોલેજનું નામ એક્સટર્નલ લખાઈને આવશે)
7. વિદ્યાર્થી ઘેર બેઠાં કે પોતાની પસંદગીના અન્ય સ્થળેથી ઓનલાઇન પરીક્ષા આપી શકશે જેના માટે,
 - a. વિદ્યાર્થી ડેસ્કટોપ, લેપટોપ, મોબાઇલ અથવા ટેબલેટ પૈકી કોઈપણ ઉપકરણ પર પરીક્ષા આપવાનો વિકલ્પ આપવાનો રહેશે.
 - b. ડેસ્કટોપ અથવા લેપટોપ માટે વિન્ડોઝ ૭ અથવા તેનાથી ઉપરના વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ અને ચાલુ હાલતમાં હોય તેવા વેબ કેમેરા હોવા જરૂરી છે.
 - c. મોબાઇલ અથવા ટેબલેટ ચાલુ હાલતમાં હોય તેવા ફ્રન્ટ કેમેરાથી સજ્જ હોવા જોઈએ અને Android 6.0 (માર્શમેલો) અથવા તેનાથી ઉપરના વર્ઝનવાળી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા હોવા જોઈએ. (IOS ચાલશે નહીં) તદ્દપરાંત ગૂગલ ક્રોમ (80 કે તેથી વધુ) બ્રાઉઝર હોવું આવશ્યક છે.
 - d. ઈન્ટરનેટ સ્પીડ માટે બ્રોડબેન્ડના કિસ્સામાં ઈન્ટરનેટની સ્પીડ ૧ mbps હોવી જોઈએ અને મોબાઇલ નેટવર્કના કિસ્સામાં 4G નેટવર્ક હોવું જરૂરી છે.
 - e. ચાલુ પરીક્ષામાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ નહીં તેની પૂરતી કાળજી વિદ્યાર્થીએ રાખવાની રહેશે.
 - f. જો વિદ્યાર્થી પાસે ઉપર જણાવ્યા મુજબની સુવિધા ન હોય તો ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ પસંદ કરવો હિતાવહ છે.
8. આ પસંદગી ૧૫-૧૨-૨૦૨૦ સુધીમાં આપી દેવાની રહેશે. જેમણે આ પસંદગી આપેલ નથી તેમની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે.
9. ઓનલાઇન પરીક્ષાના મહાવરા માટે અંતિમ પરીક્ષા પહેલાં એક ઓનલાઇન મોક ટેસ્ટ લેવામાં આવશે. આ મોક ટેસ્ટ આપવી ફરજિયાત છે.
10. વિકલ્પ પસંદગીમાં કોઈ મુશ્કેલી જણાય તો આપના નામ, એનરોલમેન્ટ નંબર, મોબાઇલ નંબર અને પડતી તકલીફ જણાવતો એક ઈ-મેલ covidexamcenter@gujaratuniversity.ac.in ઉપર મોકલી આપવો.